

નમસ્કાર મિત્રો

Sbiમાં કોર્પોરેટ સેલેરી પેકેજ સ્ટેટ ગવર્નમેન્ટ સેલેરી પેકેજ, સેન્ટ્રલ ગવર્નમેન્ટ સેલેરી પેકેજ, રેલવે સેલેરી પેકેજમાં જોડાઈ નીચેના લાભો મેળવી શકાય છે. જો આપનો પગાર એસબીઆઈ માં થતો હોય તો આપ જે સ્થળ પર નોકરી કરતા હોય ત્યાંથી ત્યાંના કર્મચારી હોવાનું પ્રમાણપત્ર મેળવી તથા સેલેરીસ્લીપ સાથે જોડી એસબીઆઈમાં સેલેરી પેકેજમાં જોડાવા માટેની અરજી આપી શકો છો. આ યોજનામાં નેટ monthly સેલેરીના આધારે નીચેના જેવા લાભો મળવાપાત્ર છે જો આપની નેટ મંથલી સેલેરી રૂપિયા ૧૦ હજારથી ૨૫ હજાર હોય તો આપ સિલ્વર કેટેગરીના મેમ્બર કહેવાવ. આ કેટેગરીના મેમ્બરોને નીચેના જેવા લાભો મળવાપાત્ર છે.

1. મિનિમમ બેલેન્સ ન હોય તો કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી.
2. રૂપિયા એક લાખનો એકસીડન્ટ ઇન્સ્યોરન્સ કવર થાય છે.
3. ચાલીસ હજાર સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે.
4. Multi city ચેકનો ઉપયોગ કોઈપણ બ્રાંચમાં કરી શકો છો તેમજ પેમેન્ટ માટેનો કોઈ ચાર્જ લાગશે નહિ અને ચેકબુક માટેનો પણ કોઈ ચાર્જ લાગશે નહીં.
5. પાસબુક કોઈપણ બ્રાન્ચમાં અપડેટ કરી શકશો જેનો કોઈ ચાર્જ લાગશે નહીં.
6. ડોમેસ્ટિક ક્લાસિક ડેબિટ કાર્ડ ફ્રીમાં મળશે જેનો કોઈ વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવશે નહીં.
7. એસબીઆઈના એટીએમ તેમજ અન્ય બેંકના એટીએમ પર ફ્રીમાં ટ્રાન્ઝેક્શન કરી શકશો.
8. એટીએમ કાર્ડની મદદથી પ્રતિદિન ૨૦ હજાર રૂપિયાનો ઉપાડ કરી શકશો.
9. ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા ફ્રીમાં મળશે.
10. જો આપના એકાઉન્ટમાં 35,000 રૂપિયા કરતાં વધારે રકમ જમા રહે તો ઓટોમેટીક ફિક્સ ડિપોઝીટ થઈ જાય છે આ ફિક્સ ડિપોઝીટ ઓટોમેટીક જ્યારે આપણો પૈસાની જરૂર હોય ત્યારે તૂટી પણ જાય છે.

જો આપની નેટ monthly સેલેરી 25001 રૂપિયાથી 50000 સુધીની હોય તો આપ ગોલ્ડ મેમ્બર કહેવાવ. આ મેમ્બરને નીચેના જેવા લાભો મળવાપાત્ર છે.

1. મિનિમમ બેલેન્સ ન હોય તો કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી.
2. રૂપિયા પાંચ લાખનો એકસીડન્ટ ઇન્સ્યોરન્સ કવર થાય છે.
3. પંચોતેર હજાર સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે.
4. Multi city ચેકનો ઉપયોગ કોઈપણ બ્રાંચમાં કરી શકો છો તેમજ પેમેન્ટ માટેનો કોઈ ચાર્જ લાગશે નહિ અને ચેકબુક માટેનો પણ કોઈ ચાર્જ લાગશે નહીં.
5. પાસબુક કોઈપણ બ્રાન્ચમાં અપડેટ કરી શકશો જેનો કોઈ ચાર્જ લાગશે નહીં.
6. ઇન્ટરનેશનલ gold ડેબિટ કાર્ડ ફ્રીમાં મળશે જેનો કોઈ વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવશે નહીં.

7. એસબીઆઇના એટીએમ તેમજ અન્ય બેંકના એટીએમ પર ફ્રીમાં ટ્રાન્ઝેક્શન કરી શકશો.
8. એટીએમ કાર્ડની મદદથી પ્રતિદિન 50 હજાર રૂપિયાનો ઉપાડ કરી શકશો.
9. ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા ફ્રીમાં મળશે.
10. જો આપના એકાઉન્ટમાં 35,000 રૂપિયા કરતાં વધારે રકમ જમા રહે તો ઓટોમેટીક ફ્રિક્સ ડિપોઝીટ થઈ જાય છે આ ફ્રિક્સ ડિપોઝીટ ઓટોમેટીક જ્યારે આપણે પૈસાની જરૂર હોય ત્યારે તૂટી પણ જાય છે.
11. જો આપની પાસે ગોલ્ડ ડેબિટ કાર્ડ હોય તો રૂપિયા બે લાખનો વધારાનો એક્સિડન્ટ ઇન્સ્યુરન્સ કવર થાય છે.
12. જો તમે ડેબિટ કાર્ડ કે ઇન્ટરનેટ બેન્કિંગ ની મદદથી એર ટિકિટ ખરીદી હોય તો હવાઈ મૃત્યુના કિસ્સામાં પાંચ લાખ રૂપિયા સુધીનો એર એક્સીડન્ટ insurance કવર થાય છે.
13. જો આપ ગોલ્ડ ડેબિટ કાર્ડ ધરાવતા હોય તો રૂપિયા ચાર લાખનો વધારાનો એર એક્સીડન્ટ insurance કવર થાય છે.

જો આપ 50001 રૂપિયાથી એક લાખ રૂપિયા સુધીની નેટ monthly સેલેરી મેળવતા હોવ તો આપ ડાયમંડ કેટેગરીના મેમ્બર કહેવાવ. આ કેટેગરીના મેમ્બરને નીચેના જેવા લાભો મળવાપાત્ર છે.

નમસ્કાર મિત્રો

Sbiમાં કોર્પોરેટ સેલેરી પેકેજ સ્ટેટ ગવર્નમેન્ટ સેલેરી પેકેજ, સેન્ટ્રલ ગવર્નમેન્ટ સેલેરી પેકેજ, રેલવે સેલેરી પેકેજમાં જોડાઈ નીચેના લાભો મેળવી શકાય છે. જો આપનો પગાર એસબીઆઈ માં થતો હોય તો આપ જે સ્થળ પર નોકરી કરતા હોય ત્યાંથી ત્યાંના કર્મચારી હોવાનું પ્રમાણપત્ર મેળવી તથા સેલેરીસ્લીપ સાથે જોડી એસબીઆઈમાં સેલેરી પેકેજમાં જોડાવા માટેની અરજી આપી શકો છો. આ યોજનામાં નેટ monthly સેલેરીના આધારે નીચેના જેવા લાભો મળવાપાત્ર છે જો આપની નેટ મંથલી સેલેરી રૂપિયા ૧૦ હજારથી ૨૫ હજાર હોય તો આપ સિલ્વર કેટેગરીના મેમ્બર કહેવાવ. આ કેટેગરીના મેમ્બરોને નીચેના જેવા લાભો મળવાપાત્ર છે.

1. મિનિમમ બેલેન્સ ન હોય તો કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી.
2. રૂપિયા એક લાખનો એક્સીડન્ટ ઇન્સ્યુરન્સ કવર થાય છે.
3. ચાલીસ હજાર સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે.
4. Multi city ચેકનો ઉપયોગ કોઈપણ બ્રાંચમાં કરી શકો છો તેમજ પેમેન્ટ માટેનો કોઈ ચાર્જ લાગશે નહિ અને ચેકબુક માટેનો પણ કોઈ ચાર્જ લાગશે નહીં.
5. પાસબુક કોઈપણ બ્રાન્ચમાં અપડેટ કરી શકશો જેનો કોઈ ચાર્જ લાગશે નહીં.
6. ડોમેસ્ટિક ક્લાસિક ડેબિટ કાર્ડ ફ્રીમાં મળશે જેનો કોઈ વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવશે નહીં.
7. એસબીઆઇના એટીએમ તેમજ અન્ય બેંકના એટીએમ પર ફ્રીમાં ટ્રાન્ઝેક્શન કરી શકશો.
8. એટીએમ કાર્ડની મદદથી પ્રતિદિન ૨૦ હજાર રૂપિયાનો ઉપાડ કરી શકશો.
9. ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા ફ્રીમાં મળશે.

10. જો આપના એકાઉન્ટમાં 35,000 રૂપિયા કરતાં વધારે રકમ જમા રહે તો ઓટોમેટીક ફિક્સ ડિપોઝીટ થઈ જાય છે આ ફિક્સ ડિપોઝીટ ઓટોમેટીક જ્યારે આપણે પૈસાની જરૂર હોય ત્યારે તૂટી પણ જાય છે.

જો આપની નેટ monthly સેલરી 25001 રૂપિયાથી 50000 સુધીની હોય તો આપ ગોલ્ડ મેમ્બર કહેવાવ. આ મેમ્બરને નીચેના જેવા લાભો મળવાપાત્ર છે.

1. મિનિમમ બેલેન્સ ન હોય તો કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી.
2. રૂપિયા પંદર લાખનો એક્સીડન્ટ ઇન્સ્યુરન્સ કવર થાય છે.
3. એક લાખ પચાસ હજાર સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે.
4. Multi city ચેકનો ઉપયોગ કોઈપણ બ્રાંચમાં કરી શકો છો તેમજ પેમેન્ટ માટેનો કોઈ ચાર્જ લાગશે નહિ અને ચેકબુક માટેનો પણ કોઈ ચાર્જ લાગશે નહીં.
5. પાસબુક કોઈપણ બ્રાંચમાં અપડેટ કરી શકશો જેનો કોઈ ચાર્જ લાગશે નહીં.
6. ઇન્ટરનેશનલ gold ડેબિટ કાર્ડ ફ્રીમાં મળશે જેનો કોઈ વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવશે નહીં.
7. એસબીઆઇના એટીએમ તેમજ અન્ય બેંકના એટીએમ પર ફ્રીમાં ટ્રાન્ઝેક્શન કરી શકશો.
8. એટીએમ કાર્ડની મદદથી પ્રતિદિન 50 હજાર રૂપિયાનો ઉપાડ કરી શકશો.
9. ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા ફ્રીમાં મળશે.
10. જો આપના એકાઉન્ટમાં 35,000 રૂપિયા કરતાં વધારે રકમ જમા રહે તો ઓટોમેટીક ફિક્સ ડિપોઝીટ થઈ જાય છે આ ફિક્સ ડિપોઝીટ ઓટોમેટીક જ્યારે આપણે પૈસાની જરૂર હોય ત્યારે તૂટી પણ જાય છે.
11. જો આપની પાસે ગોલ્ડ ડેબિટ કાર્ડ હોય તો રૂપિયા બે લાખનો વધારાનો એક્સિડન્ટ ઇન્સ્યુરન્સ કવર થાય છે.
12. જો તમે ડેબિટ કાર્ડ કે ઇન્ટરનેટ બેન્કિંગ ની મદદથી એર ટિકિટ ખરીદી હોય તો હવાઈ મૃત્યુના કિસ્સામાં વીસ લાખ રૂપિયા સુધીનો એર એક્સીડન્ટ insurance કવર થાય છે.
13. જો આપ ગોલ્ડ ડેબિટ કાર્ડ ધરાવતા હોય તો રૂપિયા ચાર લાખનો વધારાનો એર એક્સીડન્ટ insurance કવર થાય છે.
14. વાર્ષિક લોકર ચાર્જમાં 15% કન્સેશન મળે છે.

જો આપ એક લાખ રૂપિયા કે તેનાથી વધારે નેટ monthly સેલરી ધરાવતા હોય તો આપ પ્લેટિનિયમ કેટેગરીના મેમ્બર કહેવાવ. આ મેમ્બરને નીચેના જેવા લાભો મળવાપાત્ર છે.

નમસ્કાર મિત્રો

Sbiમાં કોર્પોરેટ સેલેરી પેકેજ સ્ટેટ ગવર્નમેન્ટ સેલેરી પેકેજ ,સેન્ટ્રલ ગવર્નમેન્ટ સેલેરી પેકેજ, રેલવે સેલેરી પેકેજમાં જોડાઈ નીચેના

લાભો મેળવી શકાય છે. જો આપનો પગાર એસબીઆઈ માં થતો હોય તો આપ જે સ્થળ પર નોકરી કરતા હોય ત્યાંથી ત્યાંના કર્મચારી હોવાનું પ્રમાણપત્ર મેળવી તથા સેલેરીસ્લીપ સાથે જોડી એસબીઆઈમાં સેલેરી પેકેજમાં જોડાવા માટેની અરજી આપી શકો છો. આ યોજનામાં નેટ monthly સેલેરીના આધારે નીચેના જેવા લાભો મળવાપાત્ર છે જો આપની નેટ મંથલી સેલેરી રૂપિયા ૧૦ હજારથી ૨૫ હજાર હોય તો આપ સિલ્વર કેટેગરીના મેમ્બર કહેવાવ. આ કેટેગરીના મેમ્બરોને નીચેના જેવા લાભો મળવાપાત્ર છે.

1. મિનિમમ બેલેન્સ ન હોય તો કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી.
2. રૂપિયા એક લાખનો એક્સીડન્ટ ઇન્સ્યુરન્સ કવર થાય છે.
3. ચાલીસ હજાર સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે.
4. Multi city ચેકનો ઉપયોગ કોઈપણ બ્રાંચમાં કરી શકો છો તેમજ પેમેન્ટ માટેનો કોઈ ચાર્જ લાગશે નહિ અને ચેકબુક માટેનો પણ કોઈ ચાર્જ લાગશે નહીં.
5. પાસબુક કોઈપણ બ્રાન્ચમાં અપડેટ કરી શકશો જેનો કોઈ ચાર્જ લાગશે નહીં.
6. ડોમેસ્ટિક ક્લાસિક ડેબિટ કાર્ડ ફ્રીમાં મળશે જેનો કોઈ વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવશે નહીં.
7. એસબીઆઈના એટીએમ તેમજ અન્ય બેંકના એટીએમ પર ફ્રીમાં ટ્રાન્ઝેક્શન કરી શકશો.
8. એટીએમ કાર્ડની મદદથી પ્રતિદિન ૨૦ હજાર રૂપિયાનો ઉપાડ કરી શકશો.
9. ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા ફ્રીમાં મળશે.
10. જો આપના એકાઉન્ટમાં 35,000 રૂપિયા કરતાં વધારે રકમ જમા રહે તો ઓટોમેટીક ફિક્સ ડિપોઝીટ થઈ જાય છે આ ફિક્સ ડિપોઝીટ ઓટોમેટીક જ્યારે આપણે પૈસાની જરૂર હોય ત્યારે તૂટી પણ જાય છે.

જો આપની નેટ monthly સેલેરી 25001 રૂપિયાથી 50000 સુધીની હોય તો આપ ગોલ્ડ મેમ્બર કહેવાવ. આ મેમ્બરને નીચેના જેવા લાભો મળવાપાત્ર છે.

1. મિનિમમ બેલેન્સ ન હોય તો કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી.
2. રૂપિયા પાંચ લાખનો એક્સીડન્ટ ઇન્સ્યુરન્સ કવર થાય છે.
3. પંચોતેર હજાર સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે.
4. Multi city ચેકનો ઉપયોગ કોઈપણ બ્રાંચમાં કરી શકો છો તેમજ પેમેન્ટ માટેનો કોઈ ચાર્જ લાગશે નહિ અને ચેકબુક માટેનો પણ કોઈ ચાર્જ લાગશે નહીં.
5. પાસબુક કોઈપણ બ્રાન્ચમાં અપડેટ કરી શકશો જેનો કોઈ ચાર્જ લાગશે નહીં.
6. ઇન્ટરનેશનલ gold ડેબિટ કાર્ડ ફ્રીમાં મળશે જેનો કોઈ વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવશે નહીં.
7. એસબીઆઈના એટીએમ તેમજ અન્ય બેંકના એટીએમ પર ફ્રીમાં ટ્રાન્ઝેક્શન કરી શકશો.
8. એટીએમ કાર્ડની મદદથી પ્રતિદિન 50 હજાર રૂપિયાનો ઉપાડ કરી શકશો.

9. ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા ફ્રીમાં મળશે.

10. જો આપના એકાઉન્ટમાં 35,000 રૂપિયા કરતાં વધારે રકમ જમા રહે તો ઓટોમેટીક ફિક્સ ડિપોઝીટ થઈ જાય છે આ ફિક્સ ડિપોઝિટ ઓટોમેટીક જ્યારે આપણે પૈસાની જરૂર હોય ત્યારે તૂટી પણ જાય છે.

11. જો આપની પાસે ગોલ્ડ ડેબિટ કાર્ડ હોય તો રૂપિયા બે લાખનો વધારાનો એક્સિડન્ટ ઇન્સ્યુરન્સ કવર થાય છે.

12. જો તમે ડેબિટ કાર્ડ કે ઇન્ટરનેટ બેન્કિંગ ની મદદથી એર ટિકિટ ખરીદી હોય તો હવાઈ મૃત્યુના કિસ્સામાં પાંચ લાખ રૂપિયા સુધીનો એર એક્સીડન્ટ insurance કવર થાય છે.

13. જો આપ ગોલ્ડ ડેબિટ કાર્ડ ધરાવતા હોય તો રૂપિયા ચાર લાખનો વધારાનો એર એક્સીડન્ટ insurance કવર થાય છે.

જો આપ 50001 રૂપિયાથી એક લાખ રૂપિયા સુધીની નેટ monthly સેલેરી મેળવતા હોવ તો આપ ડાયમંડ કેટેગરીના મેમ્બર કહેવાવ. આ કેટેગરીના મેમ્બરને નીચેના જેવા લાભો મળવાપાત્ર છે.

નમસ્કાર મિત્રો

Sbiમાં કોર્પોરેટ સેલેરી પેકેજ સ્ટેટ ગવર્નમેન્ટ સેલેરી પેકેજ, સેન્ટ્રલ ગવર્નમેન્ટ સેલેરી પેકેજ, રેલવે સેલેરી પેકેજમાં જોડાઈ નીચેના લાભો મેળવી શકાય છે. જો આપનો પગાર એસબીઆઈ માં થતો હોય તો આપ જે સ્થળ પર નોકરી કરતા હોય ત્યાંથી ત્યાંના કર્મચારી હોવાનું પ્રમાણપત્ર મેળવી તથા સેલેરીસ્લીપ સાથે જોડી એસબીઆઈમાં સેલેરી પેકેજમાં જોડાવા માટેની અરજી આપી શકો છો. આ યોજનામાં નેટ monthly સેલેરીના આધારે નીચેના જેવા લાભો મળવાપાત્ર છે જો આપની નેટ મંથલી સેલરી રૂપિયા ૧૦ હજારથી ૨૫ હજાર હોય તો આપ સિલ્વર કેટેગરીના મેમ્બર કહેવાવ. આ કેટેગરીના મેમ્બરોને નીચેના જેવા લાભો મળવાપાત્ર છે.

1. મિનિમમ બેલેન્સ ન હોય તો કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી.

2. રૂપિયા એક લાખનો એક્સીડન્ટ ઇન્સ્યુરન્સ કવર થાય છે.

3. ચાલીસ હજાર સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે.

4. Multi city ચેકનો ઉપયોગ કોઈપણ બ્રાંચમાં કરી શકો છો તેમજ પેમેન્ટ માટેનો કોઈ ચાર્જ લાગશે નહિ અને ચેકબુક માટેનો પણ કોઈ ચાર્જ લાગશે નહીં.

5. પાસબુક કોઈપણ બ્રાન્ચમાં અપડેટ કરી શકશો જેનો કોઈ ચાર્જ લાગશે નહીં.

6. ડોમેસ્ટિક ક્લાસિક ડેબિટ કાર્ડ ફ્રીમાં મળશે જેનો કોઈ વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવશે નહીં.

7. એસબીઆઈના એટીએમ તેમજ અન્ય બેંકના એટીએમ પર ફ્રીમાં ટ્રાન્ઝેક્શન કરી શકશો.

8. એટીએમ કાર્ડની મદદથી પ્રતિદિન ૨૦ હજાર રૂપિયાનો ઉપાડ કરી શકશો.

9. ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા ફ્રીમાં મળશે.

10. જો આપના એકાઉન્ટમાં 35,000 રૂપિયા કરતાં વધારે રકમ જમા રહે તો ઓટોમેટીક ફિક્સ ડિપોઝીટ થઈ જાય છે આ ફિક્સ ડિપોઝિટ ઓટોમેટીક જ્યારે આપણે પૈસાની જરૂર હોય ત્યારે તૂટી પણ જાય છે.

જો આપની નેટ monthly સેલરી 25001 રૂપિયાથી 50000 સુધીની હોય તો આપ ગોલ્ડ મેમ્બર કહેવાવ. આ મેમ્બરને નીચેના જેવા લાભો મળવાપાત્ર છે.

1. મિનિમમ બેલેન્સ ન હોય તો કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી.
2. રૂપિયા વીસ લાખનો એક્સીડન્ટ ઇન્સ્યોરન્સ કવર થાય છે.
3. બે લાખ સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે.
4. Multi city ચેકનો ઉપયોગ કોઈપણ બ્રાંચમાં કરી શકો છો તેમજ પેમેન્ટ માટેનો કોઈ ચાર્જ લાગશે નહિ અને ચેકબુક માટેનો પણ કોઈ ચાર્જ લાગશે નહીં.
5. પાસબુક કોઈપણ બ્રાન્ચમાં અપડેટ કરી શકશો જેનો કોઈ ચાર્જ લાગશે નહીં.
6. ઇન્ટરનેશનલ પ્લેટિનિયમ ડેબિટ કાર્ડ ફ્રીમાં મળશે જેનો કોઈ વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવશે નહીં.
7. એસબીઆઇના એટીએમ તેમજ અન્ય બેંકના એટીએમ પર ફ્રીમાં ટ્રાન્ઝેક્શન કરી શકશો.
8. એટીએમ કાર્ડની મદદથી પ્રતિદિન 1 લાખ રૂપિયાનો ઉપાડ કરી શકશો.
9. ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા ફ્રીમાં મળશે.
10. જો આપના એકાઉન્ટમાં 35,000 રૂપિયા કરતાં વધારે રકમ જમા રહે તો ઓટોમેટીક ફિક્સ ડિપોઝીટ થઈ જાય છે આ ફિક્સ ડિપોઝીટ ઓટોમેટીક જ્યારે આપણો પૈસાની જરૂર હોય ત્યારે તૂટી પણ જાય છે.
11. જો આપની પાસે પ્લેટિનિયમ ડેબિટ કાર્ડ હોય તો રૂપિયા પાંચ લાખનો વધારાનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ કવર થાય છે.
12. જો તમે ડેબિટ કાર્ડ કે ઇન્ટરનેટ બેન્કિંગ ની મદદથી એર ટિકિટ ખરીદી હોય તો હવાઈ મૃત્યુના કિસ્સામાં ત્રીસ લાખ રૂપિયા સુધીનો એર એક્સીડન્ટ insurance કવર થાય છે.
13. જો આપ પ્લેટિનિયમ ડેબિટ કાર્ડ ધરાવતા હોય તો રૂપિયા 10 લાખનો વધારાનો એર એક્સીડન્ટ insurance કવર થાય છે.
14. વાર્ષિક લોકર ચાર્જમાં 25% કન્સેશન મળે છે.

વધુમાં વધુ લોકો સુધી શેર કરશોજી.

- યુડાસમા દેવેન્દ્રસિંહ વનરાજસિંહ

મદદનીશ શિક્ષક

શ્રી ભોજપરા પ્રાથમિક શાળા

તા.જી. ભાવનગર